

ચૈત્યાત્માની ત્રિવિધ શક્તિઓ

વસ્તુનિર્દેશ

અહીં એક નીચી ઉદાસીન ભોમ આગળથી આરોહવાનો ઉત્સાહ આરંભાતો હતો. ત્યાં કાળા વાળના વાદળમાં ચંદ્રમા સમાન વદનવાળી એક સ્ત્રી દેખાઈ. ખડબચડી જમીન ઉપર આવેલા એક ઘાયલ કરતા તીણા પથર ઉપર એના પગ રાખેલા હતા. જગતની ટૂકો ઉપરની એ દિવ્ય દયા હતી અને સંસારને પોતાના દુઃખભર્યા દેહ રૂપે સ્વીકારી લઈ એ સર્વેના સંતાપ અવલોકી રહી હતી. સાત સંતાપોની એ માતાના હૃદયે સાત ઘા ઝરતા હતા. એક ઊંડી કરુણાના રસમાં એ લીન હતી. એણે કોમળ સ્વરે શરૂ કર્યું :

"ઓ સાવિત્રી ! હું તારો છૂપો આત્મા છું. મારાં સંતાનોના સંતાપો હું મારા હૃદયમાં લઈ લઉં છું. દેવોના નિર્દ્ય સમારની નીચે દુઃખથી અમળાનારાઓનો હું આત્મા છું. હું સ્ત્રી છું, ધાત્રી છું, ગુલામડી છું, પરોણા ખાતું પશુ છું. મને મારનારના હસ્ત ઉપર પણ હું હેતથી હાથ ફેરવું છું, મારા પ્રેમને તુચ્છકારનારની પણ હું સેવાચાકરી કરું છું, માનીતી રાણીને સ્થાને રહું છું ને લાડવાયી ઢીગલી પણ બનું છું. હું અન્નપૂર્ણ છું, પૂજાતી ગૂહદેવતા છું, આચરાતા લાખલાખ અત્યાચારો જોયા છતાંય હું કશું કરી શકી નથી. બચાવવાનું બણ મારામાં નથી. માત્ર મારી નિર્ઝળ પ્રાર્થના ઊર્ધ્વ આરોહતી રહી છે. મારામાં એક અંધ શ્રદ્ધા અને દામણી દયા રહેલાં છે. પ્રભુ પ્રત્યે પેખતી આશા મારામાં છે. 'હું આવું છું' એવું પ્રભુ કહે છે પણ હજુ સુધી એ આવ્યો નથી. છતાંય હું જાણું છું કે એ આખરે આવશે."

એ જેવી બોલતી બંધ પડી તેવા જ એના દયાભાવના જવાબમાં એક સમયનો દેવ એવા એક રિબાતા અસુરનો અવાજ ગાજ ઊઠ્યો :

"હું વિચાદોનો માનુષ છું. મારી વેદનાઓનો આનંદ લેવા માટે પ્રભુએ પૂછ્યી બનાવી છે. વિશ્વવિશાળ કોસ ઉપર મને ભીલે મારેલો છે. અનિવાર્ય અભિનની મેં શોધ કરી છે ને પોતે પેટાવેલા પાવકમાં હું કૂદા માફક બળું છું. હું કરવા માગું છું તે હું કદી કરી શકતો નથી. મારા

વિચારની ધારથી નરક, અને મારા સ્વખના મહિમાથી સ્વર્ગ મને રિબાવે છે. હું છું બંડખોર પણ નિઃસહાય. ભવ અને ભાગ્ય મને છેતરે છે અને મારી મહેનતનું બધું પડાવી લે છે. મને ગુલામીના પાઠો પઢાવાય છે. પ્રભુ સામે ને માનવ સામે મારો વિરોધ છે. દયા દુર્બળતા છે. એકવાર મારો જ્વાળામુખી ફાટી નીકળશે તો હું સારા સંસાર ઉપર મારું સામ્રાજ્ય સ્થાપીશ ને ઈશ્વરની જેમ મનુષ્યોનાં સુખદુઃખનો ઉપભોગ કરીશ. દુઃખ સહેવામાં મારી શ્રેષ્ઠતા રહેલી છે. હું દુષ્ટ છું ને દુષ્ટ રહીશ; હું દુઃખ વેઠીશ, જહેમત ઉઠાવીશ, રડીશ અને ઘિક્કારીશ."

સાવિત્રીએ સાંભળ્યું ને પોતાના દયાના સ્વરૂપની પ્રતિ વળી ઉચ્ચાર્યુઃ "ઓ દિવ્ય દયાની દુઃખમયી દેવી ! તું મારું જ એક પ્રકટ અંશસ્વરૂપ છે. તું છે તેથી મનુષ્યો દુર્ભાગ્યવશ થઈ જતા નથી. એક દિવસ બળ લઈને હું પાછી આવીશ ને તારાં અંગો ઓજથી ઊભરાઈ જશે, જ્ઞાન તારા ભાવિક હૃદયનું સંચાલન કરશે, તારો પ્રેમ માનવજાતને બાંધશે, દુઃખ દુનિયામાંથી દેશનિકાલ થશે, રાક્ષસી કૂરતામાંથી જગત મુક્ત બનશે ને સર્વે સદાકાળ સુખશાંતિમાં સહેલશે."

સાવિત્રી આગળ ચાલી. ત્યાં આત્માના ઉર્ધ્વમાર્ગ સર્વ કંઈ સુંદર હતું. અહીં એક શિલામય સિંહાસન ઉપર એક સ્ત્રીનાં દર્શન થયાં. સોનેરી-જામલી એનાં વસ્ત્રો હતાં. એના હાથમાં હતું ત્રિશૂલ ને વજ્ર; એક પોઢેલા સિંહની પીઠ ઉપર એના પાય હતા. પાતાળનાં સત્ત્વો એનાથી ભય પામતાં હતાં. એ હતી શક્તિસ્વરૂપિણી દેવી. એ બોલી :

"સાવિત્રી ! હું તારો ગુપ્ત ચિદાત્મા છું. આ જગતમાં ઉત્તરી આવીને હું હૈવી ને આસુરી શક્તિઓના યુદ્ધને જોઈ રહી છું. હું દુર્ભાગીઓને સહાય કરું છું, વિનાશ પામવા બેઠેલાઓને બચાવી લઉં છું. દલિતોના પોકારો પ્રત્યે મારા શ્રવણ વળેલા છે. અત્યાચારીઓનાં સિંહાસન હું ઉથલાવી નાખું છું. તજાયેલાઓ અને તુરંગનો ત્રાસ વેઠનારાઓ મારા આવાગમનની વાટ જોતા હોય છે. હું છું દુર્ગા, અસુરવિનાશિની, દૈત્યોને એમની બોડમાં જ પૂરા કરનારી દેવી. સૌભાગ્યશાળીઓની હું લક્ષ્મી છું. સંહાર સમયે હું કાલીનું મુખ ધારણ કરું છું. પ્રભુએ મને એના કામની સોંપણી કરી છે ને કશાનીધ પરવા કર્યા વગર હું તે કરતી રહું છું. થોડાકને હું પ્રકાશ પ્રત્યે દોરી જઉં છું, થોડાકને હું બચાવી લઉં છું. પણ મોટા ભાગના અરક્ષિત રહેલા પાછા પડે

છે. મારા કઠોર કાર્યને માટે મેં મારા હદ્દયને કઠોર બનાવ્યું છે. ધીરે ધીરે પૂર્વમાં પ્રકાશ પ્રકટે છે, જગત ધીરે ધીરે પ્રભુને માર્ગ પ્રગતિ કરે છે. પ્રભુ જ્યારે પૃથ્વીના આત્માને મળવા પ્રકટ થશે ત્યારે હું સ્વર્ગના રૂપેરી દરવાજાનો રૂપારવ સાંભળીશ."

આના ઉત્તર રૂપે નીચેના માનવ લોકમાંથી એક પ્રતિધ્વનિ આવ્યો. શુંખલિત વામણા દૈત્ય માનસમાં થઈ એ પસાર થયો હતો, કામનાના આ મોટા જગતનો અહંકાર બોલતો હતો. માણસના ઉપયોગ માટે એ પૃથ્વી અને સ્વર્ગ ઉપર અધિકાર ધરાવવા વાંछતો હતો. વિચાર કરતું પશુ પ્રકૃતિનો પ્રભુ બનવા માગતું હતું. એની પીડાઓ એની પ્રગતિનું સાધન છે. એનું મૃત્યુ અંમૃતત્વની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. એનો આત્મા પ્રકૃતિનો મહેમાન છે. એનું સચેત મન પ્રકૃતિનો બળવાન ને બંડખોર સેવક છે. અવાજ આવ્યો:

"હું પૃથ્વીની શક્તિઓનો વારસ છું, એના કીચડમાં વિકસિત થતું દૈવત છું. સ્વર્ગના સિંહાસન પર મારો દાવો છે. પાંચે તત્ત્વો મારે માટે જ અસ્તિત્વ ધરાવે છે. હું એમને મારી સેવામાં પલોટું છું. અજ્ઞાન અને અભ્યં જન્મેલો હું પ્રકૃતિથી વધારે મોટો અને ઈશ્વરથી વધારે ડાઢ્યો છું. પ્રભુએ અધૂરું રાખેલું હું પૂરું કરું છું. પ્રથમ ઝાંચા પ્રભુ, તો હું અંતિમ ઝાંચા છું. પંચ તત્ત્વ ઉપર પ્રભુત્વ મેળવીને હું મારા ચમત્કારોનાં યંત્રો ચલાવીશ. સ્થૂલ તેમ જ સૂક્ષ્મના કાયદા મારા કબજ્ઞામાં આવશે. પૃથ્વીનો પ્રભુ બનીને હું સ્વર્ગને સર કરીશ."

સાવિત્રી પોતાની શક્તિના સ્વરૂપને સંબોધી બોલી:

"ઓ શક્તિસ્વરૂપિણી દેવી! તું મારા આત્માનો એક અંશ છે. કાળના મહાપ્રયત્નને ને મનુષ્ય જાતિને મદદગાર થવું એ તારું કામ છે. તું છે તેથી તો માણસ આશા રાખે છે ને હામ ભીડે છે, આત્માઓ સ્વર્ગારોહણ કરી શકે છે ને પરમાત્મદેવની સમીપમાં દેવો સમાન ચાલી શકે છે. પણ જ્ઞાન વગરની એકલી શક્તિ હવાઈ છે, એ શાશ્વત વસ્તુઓનું મંડાણ કરી શકતી નથી. એક દિન હું પાછી આવીશ અને પ્રકાશ લાવીશ. તારું જ્ઞાન અને તારી શક્તિ ઉભય બૃહદાકાર બની જશે. મનુષ્યો દ્વેષરદિત બની જશે, દુર્બળતા દૂર થઈ જશે, અહંકાર ઓગળી જશે ને બધું જ બળપૂર્ણ, પરમાનંદપૂર્ણ બની જશે."

આગળ આરોહતાં સાવિત્રી એક ઉન્નત ને સુખારામભર્યા સ્થાનમાં આવી. એક જ દૃષ્ટિએ ત્યાંથી બધું જોઈ શકતું હતું, સર્વ ત્યાં સામંજસ્યભર્યું હતું. ત્યાંના સ્ફાટિકશુચિ પ્રકાશમાં એક દેવી બિરાજેલી હતી. એણે મંદ સંગીતમય સુસ્વરે સાવિત્રીને સંબોધી:

"સાવિત્રી! હું તારો ગૂઢ આત્મા છું. ઘવાયેલી વેરાન પૃથ્વીના ઘા કુઝાવવા ને એના હદ્યને સુખશાંતિએ ભરવા માટે હું આવેલી છું. હું છું શાંતિ ને છું પ્રેમપૂર્ણ દ્યાભાવ, હું મૌન છું, વિશ્વના નક્શાનો અભ્યાસ કરતું જ્ઞાન છું, શુભમાં શુભ માટે હું શ્રમ સેવું છું, પ્રભુ માટે કાર્યરત રહું છું, સ્ખલનોનેય આરોહણનાં પગથિયાંમાં પલટાવી દઉં છું.

પ્રભુ અનેક સ્વરૂપોએ મનુષ્યમાં વૃદ્ધિ પામે છે, ને માનવ માટીને સ્વર્ગના સુવર્ણનું રૂપ આપે છે. પ્રભુ શુભ છે, પ્રભુ અનિષ્ટો સામેનું પવિત્ર યુદ્ધ છે, ચિત્તાભસ્મમાંથી ઊભી થતી મુક્તિ છે. વિકટ વાટની રક્ષા કરતી મરણિયણ વીરતા છે, ધોર રાત્રિના હદ્યમાં પહેરો ભરતો સંતરી છે, પ્રભુ જ્ઞાન છે, એકલવાયો ઉન્નત વિચાર છે, પયગંબરી શબ્દ છે, મનોહર સૌન્દર્ય છે, સત્ય છે, બૃહદાત્માની મહાસંપત્તિ છે, અણુમાં અંતલીન અનંતતા છે, મૃત્યુની ભુજાઓમાં ભરાયેલી અમરતા છે. સાન્ત વસ્તુના વિચારને અનંતતા વરશે, શાશ્વતતા કાળનું કાંદું પકડશે ત્યારે મનુષ્ય પોતાની કુદ્રતામાંથી મુક્ત થશે અને પ્રભુનો અંતેવાસી બની જશે. તે દરમિયાન હું પૃથ્વી ઉપર દેવાત્માઓને ઉતારું છું, આશાનું ઉદ્ધીપન કરું છું. રાય અને રંકને શાંતિ સમર્પું છું, અજ્ઞ તેમ જ પ્રજ્ઞાની ઉપર કૃપા દર્શાવતી રહું છું. પૃથ્વી કબૂલ થશે તો હું એને બચાવી લઈશ.

એ બોલી ને પાતાળપ્રદેશમાંથી એક વિકૃત અને ધ્રુજારીએ ભરેલો પડધો આવ્યો. ઈન્દ્રિયોથી શુંખલિત થયેલું માનવ મન ઈશ્વરી શક્તિ સામે ગર્વિષ્ઠ આકોશ કરવા લાગ્યું. માણસ સપાટીઓ જ જુએ છે, થોડાક ઊંડાણમાં ઊતરી શકે છે, પણ સત્યના આત્માને જોઈ શકતો નથી. આકળો બનીને એ જ્ઞાન માટે તરવાર ચલાવી જુએ છે, પણ એના ઘાથી સત્યનો આત્મા કાં તો છટકી જાય છે, કાં તો મરણશરણ થાય છે, એને તર્કસિદ્ધ ગોચર વસ્તુ જ ખાતરીબંધ જણાય છે. એનું જ્ઞાન અજ્ઞાનના મહાસાગરના કાંઠા ઉપરના કાંકરા જેવું જ હોય છે. આમ છતાંય ઊઠેલા આકોશમાં ભવ્યતાનો સ્વરભાર હતો, વિશ્વવ્યાપી કારુણ્ય એના સૂરમાં કંપમાન બનેલું હતું:

"હું પ્રભુના મોટા અજ્ઞાની જગતનું મન છું, ને એનાં રચેલાં પગથિયાં પર થઈ જ્ઞાનની દિશામાં આરોહતું રહ્યું છું. છે તે સર્વની શોધે લાગેલો હું વિચાર છું, જડ પદાર્થ ને ગોચરતાની સાંકળે બંધાયેલો દેવ છું, કાંટાળી વાડમાં પુરાયેલું પશુ છું, એરણ સાથે અટવાઈ ગયેલો લુહાર છું. મેં આકાશના અને આકાશના તારાઓના માપસર નકશા દોય્યા છે, એમના આયુષ્યનો અડસણો કાઢ્યો છે, પૃથ્વીના પેટાળમાં પ્રવેશી ત્યાંની સંપત્તિ બહાર ખેંચી કાઢી છે. પદાર્થ વિજ્ઞાનની પદ્ધતિએ મેં ધણું ધણું પ્રાપ્ત કર્યું છે, પૃથ્વીનું, જીવનનું, જીવાણુઓનું, વનસ્પતિનું, માણસની ઉત્પત્તિ અને વંશાવલિનું જ્ઞાન મેં મેળવ્યું છે. પ્રભુ જો કામ કરતો હોય તો તેનાં રહસ્યો મેં શોધી કાઢ્યાં છે. જોકે હજુ કેટલુંક રહસ્યમય જેવું રહ્યું ગયું છે તો પણ તે જાઝો સમય એવું નહિ રહે.

મારી મોટી ફિલ્મસૂફીઓ તાર્કિક અનુમાનો છે, ગૂઢ સ્વર્ગો ભેજાની કલ્પનાની કરામતો છે, બધું જ અડસણો છે, સ્વર્ણ છે. એમાં પડ્યા વિના મને મારી મર્યાદાઓમાં રહીને જ કામ કરવા દો. પ્રાણીમાત્રને મર્યાદા છે ને તેમાં જ એને રહેવાનું છે. માણસ શી રીતે અમર અને દિવ્ય બની શકે? માયાવી દેવતાઓ એવાં સ્વર્ણ ભલે સેવે, વિચારવંત મનુષ્ય તેમ નહિ કરે."

સાવિત્રીએ સ્વર ને એનો વિકૃત ઉત્તર સાંભળ્યો, ને એ પોતાના પ્રકાશના સ્વરૂપ પ્રત્યે વળીને બોલી:

"ઓ પ્રકાશની દેવી! સુખ અને શાંતિની માતા! તું મારો જ એક પ્રકટ અંશ છે. તું છે તેથી આત્મા વિસ્મૃત શિખરોએ આરોહશે ને ચૈત્ય પુરુષ સ્વલ્પોકના સ્પર્શથી જાગ્રત થશે. તું છે તેથી જીવ શિવની સમીપ સરે છે, દ્વેષ હોવા છતાંય પ્રેમ પ્રવૃદ્ધ થાય છે, અંધકારગર્તમાં જ્ઞાન અણહણાયેલું રહી ચાલે છે. પરંતુ કેવળ બુદ્ધિની કઠોર શિલામયી ભોમ ઉપર સ્વર્ગની સુવર્ણ વખથી કંઈ વળવાનું નથી. એના વડે પૃથ્વીની માટીમાં અમર વૃક્ષ ફાલવા ફૂલવાનું નથી, જીવનતરુની ડાળીએ બેસી દિવ્ય વિહંગમ ગાવાનું નથી, સ્વર્ગના સમીરો મર્યાદોકના વાયુમંડળમાં વાવાના નથી. અંતઃસ્હૂરણાનાં ડિરણો તું વખરિશે તોય માનવનું મન એને પાર્થિવ પ્રકાશ જ માની લેશે ને એનો આત્મા આધ્યાત્મિક અહંકારમાં અલોપ થઈ જશે, એનો ચૈત્ય આત્મા સાધુતાની કુટીરમાં જ સ્વર્ણ સેવતો ભરાઈ રહેશે ને માત્ર પ્રભુની પ્રકાશમયી

છાયાને જ ત્યાં અવકાશ મળશે. માણસની શાશ્વત માટેની કૃધા તારે પોષવાની છે, એના હદ્યને દેવોના અર્જિનથી ભરી દેવાનું છે, એના દેહમાં ને જીવનમાં પ્રભુનાં પગલાંને નીચે ઉતારી લાવવાનાં છે.

એક દિવસ પ્રભુનો હસ્ત હસ્તમાં લઈ હું પાછી ફરીશ અને તને પરમપૂર્ણનાં દર્શન થશે. તે અવસરે પરમપાવન વિવાહોત્સવ ઊજવાશે અને પ્રભુના પરિવારનો પ્રસવ થશે. ભુવને ભુવને જ્યોતિ જળહળવા માંડશે, શાશ્વત શાંતિ સર્વત્ર વ્યાપી જશે."

નિભન, નત, ઉદાસીન ભૂમિકામાંહથી અહીં
આરોહણાર્થનો આધ્ય ભાવાવેગ શરૂ થયો;
નારી એક હતી બેઠી સજી વસ્ત્રે ઝાંખા ઉજાશથી ભર્યા,
મુખ એનું શશી-શુભ વાદળા શા કણા વાળમહી હતું.
માટીનાં રૂખડાં ફેફાં સાવ સાદા એના આસનમાં હતાં,
એના ચરણની નીચે તીણો ને ધા કરતો પથરો હતો.
એ હતી કરુણા દિવ્યા શિખરો પર વિશ્વના
સ્પર્શતાં 'તાં દુઃખશોક જેને સૌ પ્રાણવંતનાં,
જોતી 'તી એ દૂર દૂર ભીતરી મનમાંહથી
બ્હારની વસ્તુઓકેરું સંહેહાત્મક આ જગત્,
જૂઠા દેખાવ છે જેમાં અને સત્યાભાસી આકૃતિઓ જઈ,
આ શંકાસ્પદ બ્રહ્માંડ વિસ્તારેલું અજ્ઞાનાત્મક શૂન્યમાં,
પીડાઓ પૂઢિવીકેરી, તારકોનો પરિશ્રમ અને ત્વરા,
જોતી જીવનનો જન્મ મુશ્કેલીએ થતો અને
અંત આત્મકથી ભર્યો.

પોતાના દુઃખના દેહરૂપે વિશ્વતણો સ્વીકાર એ કરી
સાત સંતાપની માતા સાત ધા ધારતી હતી
ને વીધાઈ એમનાથી હૈયું એનું લોહિયાળું બન્યું હતું:
વિલંબિત થતી એને મુખે સુન્દરતા હતી

ઉદાસીનપણાતણી,
પુરાણાં અશ્વને અંકે આંખો એની ઝંખવાઈ ગઈ હતી.
વેદનાથી વિશ્વકેરી હૈયું એનું વિદારાઈ ગયું હતું

ને લદાયું હતું ભારે
 કાળમાં જે હતા શોક અને સંધર્ષ, તે વડે,
 એક વ્યથિત સંગીત
 અના ભાવભર્યા સૂર પૂઠે ખેચાઈ આવતું.
 તલ્લીન ગાઢ કારુણ્યકેરી મોટી મુદામહી,
 સૌભ્ય રશિમ કરી ઉચ્ચા ઘૈર્યવંતી સ્વદૃષ્ટિનું
 મૃદુ મીઠા અને શિક્ષાદાયી શબ્દોમહી એ મંદ ઉચરી:

"હે સાવિત્રી! હું તારો ગૂઢ આત્મ છું.

આવી છું જગની પીડામહી ભાગ પડાવવા,
 લઈ હું લઉં છું હૈથે મારે દુઃખો મારાં બાળકડાંતજ્ઞાં.
 તારકોની તળે છે જે દુઃખશોક ત્યાં હું ધાત્રી બનેલ છું;
 દેવોકેરા દયાહીન દંતાળ હેઠ જે બધા
 આકોશ કરતા દુઃખે અમળાઈ રહેલ છે

તેમનો હું ચિદાત્મ છું.

છું હું નારી તથા ધાત્રી, દાસી છું હું, પશુ છું પીટ પામતું;
 કર્યા છે જેમણે કૂર ધા તે હસ્તોત્તણી સંભાળ હું લઉ;
 જે હૈયાએ ઉવેચ્છો છે મારો પ્રેમ અને ઉત્સાહ, તેમની
 સેવામાં સજ્જ હું રહું;
 છું હું આરાવિતા રાણી, ડિંગલી લાડ માણતી,
 અન્નદાત્રી, અન્નપૂર્ણા ને છું હું ગૃહદેવતા
 પૂજા અર્થન પામતી.

જે સૌ દુઃખ સહે છે ને જે સૌ આકન્ધનો કરે
 તે સૌમાં હું રહેલ છું.

પૃથ્વીથી મોઘ આરોહી જતી છે મુજ પ્રાર્થના,
 મારાં જીવંત સત્તવોની પીડાઓથી હું આકાંત થયેલ છું,
 છું હું આત્મા દુઃખની દુનિયામહી.

રિબાતી માંસમાટીની ને રિબાતાં ઉરોતણી

સ્વર્ગ જે ચીસ ના સુણી

અને પાછી ફરીને જે દેહે ને હદ્દ્યે પડી,
 તેણે વિદીષા કીધો છે આત્મા મારો

નિઃસહાય શોકથી ને પ્રકોપથી.

પોતાની જુંપડીમાં મેં નિહાળ્યો છે બળતો કુષિકારને,
મેં રેંસાતું નિહાળ્યું છે શબ મારેલ બાળનું,
મેં બળાત્કારનો ભોગ બનેલી ને
નજીન કરાયલી, ખેંચી જવાતી સ્ત્રીકેરી છે ચીસ સાંભળી
નારકી કૂતરાઓ શા ટોળાકેરી ભસાભસતણી વચે,
જોયા હું કરતી 'તી, ના હતી શક્તિ મારામાં રક્ષવાતણી.
સહાય કરવાને કે મારવાને

કો બલિષ્ઠ શસ્ત્ર લાવેલ હું નથી;

પ્રભુએ પ્રેમ આખ્યો છે મને, એની શક્તિ આપી નથી મને.

પરોજાએ ચલાવાતા કે તેજુએ પ્રેરાતા ચાબખા વડે

પશુના જોતરાયેલા શ્રમકાર્યો છે પડાવેલ ભાગ મેં;

પક્ષી ને પશુની ભોએ ભરેલી જિંદગીમહી

દ્ધું ભાગીદાર હું બની,

એની શિકારની ખોજ રોજ લાંબી દૈવ-આધીન ખાદ્યની,

લપાઈને, દબાઈને એનું ક્ષુદ્રિત ઘૂમવું,

તીક્ષ્ણ ચાંચે અને પંજે પકડાતાં પીડા ને ત્રાસ એહના

એ સૌમાં મુજ ભાગ છે.

સામાન્ય જનના નિત્ય-જીવને મુજ ભાગ છે,

એનાં છોટાં સુખોમાંહે ને છોટી ફિકરોમહી

દબાણે તકલીફોના ને અનિષ્ટોતણી જડ જમાતમાં

ન રાહતતણી આશા, એવી શોકસરણીમાં ધરાતણી,

ન ઈચ્છેલા, નિરાનંદ કંટાળો આપતા શ્રમે,

બોજામાં દુઃખના એના, ફટકાઓમહી એના નસીબના

મારો ભાગ રહેલ છે.

દ્યા બની રહું છું હું લળેલી દુઃખની પરે,

દું ઘવાયેલ હૈયાને રૂઝ દેતું મૃદુ સ્થિત,

સહાનુભૂતિ છું જેહ જિંદગીની કરે ઓછી કઠોરતા.

અદૃષ્ટ મુખ ને હસ્ત મારા સંવેદે મનુષ્ય સમીપમાં;

બની છું દુઃખ સહેનાર ને એનો આર્તનાદ હું.

કપાયેલા મરાયેલા માણસોની સંગાથે હુંય છું ટળી,
 બંદીની કોટીમાં હું કારાવાસે એની સાથે રહેલ છું,
 કાળની ધૂંસરી મારે ખલે ભારે બનેલ છે:
 સૂચ્ચિના બોજમાંથી હું ના કશું ઈનકારતી,
 સહ્યું છે મેં બધું ને હું જાણું છું કે સહેવાનું હજ્ય છે:
 છેલ્લી નિદ્રામહી જ્યારે જશે દૂબી જગત્ તદા
 કદાચ હુંય પોઢીશ મૂક શાશ્વત શાંતિમાં.
 સહી છે મેં શાંતભાવી સ્વર્ગકેરી તટસ્થતા,
 ઝૂરતા મેં નિહાળી છે દુઃખ સહેતા જીવો પ્રત્યે નિસર્જની
 ને તે વેળા ચૂપચાપ ત્યાં થઈને જતો પ્રભુ
 જોયો છે મેં, જે સહાય કરવા વળતો ન 'તો.
 છતાં પોકાર મેં કીધો નથી એની ઈચ્છાકેરી વિરુદ્ધમાં
 ને આક્ષેપ નથી મૂક્યો વિશ્વમાંના એના નિયમની પરે.
 માત્ર આ દુઃખના મોટા ને કઠોર જગને પલટાવવા
 છે ઉઠી મુજ હૈયાથી એક ધૈર્યધારજાવંત પ્રાર્થના;
 ઈશ્વરાધીનતા એક પાંડુવજી શિર મારું ઉજાળતી,
 મારામાં કરતાં વાસ અંધશ્રદ્ધા અને દયા;
 ઓલવી ન શકાતો જે કદી એવા હું વૈશ્વાનરને વહું,
 સૂર્યોને જે ટકાવે છે તે વહું કરુણા વળી.
 હું છું આશા મીટ માંડે છે જે મારા પ્રભુ પ્રતિ,
 પ્રભુ મારો ન આવ્યો જે મારી પાસે હજી સુધી;
 સ્વર એનો સુણું છું હું, ‘આવું છું હું’ એવું હમેશ જે કહે:
 જાણું છું કે આવશે એ એક દિવસ આખરે.”
 અટકી એ, અને એની દિવ્ય આ ફરિયાદમાં
 હતી કરુણતા તેના જવાબમાં
 નીચાણમાંહથી એક પડ્ઘાના સમાન ત્યાં
 ઉપાડી લઈને ધોર ટેક બોલ્યો અવાજ એક રોખનો,
 ધનગર્જનના જેવો કે કોપેલા હિંસની ત્રાણના સમો,
 જે જનાવર ગર્જ છે ઊડાણોમાંહ આપણાં,
 એકદા જે હતો દેવ એવા એક

યંત્રણા વેઠતા દૈત્યકેરો અવાજ એ હતો.

"છું મનુષ્ય વિખાઈ હું, છું હું તે જેહ વિશ્વના
વિશાળા કોસ પે ભીલે મારીને છે રખાયલો;
નિમ્ના છે પ્રભુએ પૃથ્વી માણવાને મજા મારી વ્યથાતણી,
મારો ભાવાવેશ એણે બનાવ્યો છે વિષય સ્વીય નાટકે.

મોકલ્યો છે મને એણે નરન એના કડવા જગની મહી
ને માર્યો છે મને એના દંડાઓથી શોકના ને વ્યથાતણા,
કે હું આકોશતો એના ચરણોમાં પેટ ઘસડતો પું
ને અપું અર્થના મારી મારા લોહી ને મારાં અશ્રુઓ વડે.

ચિરાતો ગીધની ચાંચે પ્રોમીથિયસ હું જ તે,
મનુષ્ય શોધ છે જેણે કરી અમર અનિની,
જગાડી જ્વાળ એણે જે તેમાં પોતે બળનારો પતંગ શો;

છું ઢૂંઢનાર જેને ના કદી પ્રાપ્તિ થઈ શકે,
છું યોદ્ધો જે કદીયે ના જ્યશાળી બની શકે,
છું દોડનાર હું જેને કદીયે ના થયો સ્પર્શ સ્વ લક્ષ્યનો;
મારા વિચારની ધારે મને નરક રીબવે,
દીપ્તિએ મુજ સ્વખોની મને સ્વર્ગ રિબાવતું.

મારા માનવ આત્માથી થયો છે લાભ શો મને?

પરિશ્રમ કરું છું હું પશુ પેઠે, પશુ પેઠે મરી જઉ.

મનુષ્ય બળવાખોર, છું દાસ નિઃસહાય હું;

ભાગ્ય ને મુજ સાથીઓ

પચાવી પાડતા મારું ઝેનતાણું ઠગી મને.

મારી દાસત્વની સીલ રક્તે મારા શિથિલાયિત હું કરું,

હુખતી મુજ બોચીથી ખંખેરી હું

નાખું છું ઢીચણો અત્યાચારોના કરનારના,

કિંતુ તે પીઠ પે મારી બીજા જુલભગારને

અસવાર બનાવવા:

મારા શિક્ષણદાતાઓ ગુલામીનો મને પાઠ પઢાવતા,

મારા ભાગ્યતણા કષ્ટદાયી કરારની પરે

બતાવાતી મને ઝોરછાપ ઈશ્વરની અને

મારી પોતાતણી સાચી સહી વળી.
 રાખ્યો છે પ્રેમ મેં, કિન્તુ મારી ઉપર કોઈએ
 પ્રેમ રાખ્યો નથી મારો થયો છે જન્મ ત્યારથી;
 બીજાઓને અપાયે છે મારું કર્મોતણું ફળ;
 મારે માટે રહે છે જે બધું તે છે મારા વિચાર પાપિયા,
 મારો કૃપણ કંકાસ પ્રભુની ને માનવીની વિરુદ્ધમાં,
 જેમાં મારો નથી હિસ્સો ને ઘનોની અદેખાઈ જ એકલી
 ને નથી જે બન્યું મારું તે સૌભાગ્ય પ્રત્યેનો દ્વેષ દાઢતો.
 જાણું છું કે રહેવાનું ભાગ્ય મારું એનું એ જ હમેશાનું,
 બદલ્યું જાય ના એવું છે એ કાર્ય એક મારા સ્વભાવનું;
 મારે ખાતર રાખ્યો છે પ્રેમ મેં, ના પ્રેમના પાત્ર કારણે,
 મેં મારી જાતને માટે સેવ્યો છે પ્રેમ, ને નથી
 બીજાંઓનાં જીવનોને બનાવ્યાં પ્રેમપાત્ર મેં.
 પ્રત્યેક આપ પોતે છે કાયદાએ નિસર્જના,
 આ પ્રકારે બનાવ્યું છે કૂર ધોર પોતાનું પ્રભુએ જગત,
 આ પ્રકારે ધરેલું છે ક્ષુદ્ર હૈયું મનુષ્યનું;
 ટકાવી શકતો માત્ર બલથી ને છલથી જન જિંદગી:
 કેમ કે છે દયા એના દ્વિલની બલહીનતા,
 એની ભલાઈ છે એક શૈથિલ્ય નાડીયંત્રનું,
 એની માયાળુતા મૂડી રોકાયેલી આશાએ બદલાતણી,
 એનું પરોપકારિત્વ મુખ બીજું ‘અહં’ તણું:
 કરે એ જગની સેવા કે જેનાથી સેવા એની કરે જગત.
 જાગે દૈવત મારામાં દૈત્યનું એકવાર જો,
 ઊઠે એદ્રનાથકી જાગી એન્સિલેડ્સ જો, તદા
 સારા જગતનો નાથ બનીને રાજ્ય હું કરું,
 ભોગવું પ્રભુની પેઠે સુખદુઃખ મનુષ્યનાં.
 પરંતુ પ્રભુએ મારું પ્રાચીન બળ છે હર્યુ.
 મંદા બનેલ હૈયામાં મારા સંમતિ મંદ છે,
 ઉંગ સંતોષ છે એક વ્યથાઓથી મારી ખાસ પ્રકારની,
 જાતીલાંઓથકી જાણે મને તેઓ વધુ ઉચ્ચ બનાવતી;

માત્ર દુઃખ સહીને હું બઢિયો જાઉ છું બની.
 ભીમકાય અનિષ્ટોનો હું છું ભોગ બની ગયો,
 દૈત્ય દારુણ કર્મોનો છું હું કર્તા,
 સર્જાયો છું અનિષ્ટાર્થ, ભાગ્યે મારે અનિષ્ટ છે;
 અનિષ્ટરૂપ છે મારે બનવાનું, જીવવાનું અનિષ્ટથી;
 કરી શકું ન બીજું કે હું જે છું તે થયા વિના;
 સ્વભાવે મુજને જેવો બનાવ્યો છે
 તેવું મારે રહેવાનું જ છે રહ્યું.

સહું છું, શ્રમ સેવું છું, રહું છું હું;
 વિલખું છું, કરતો રહું છું ઘૂણા."

સાવિત્રીએ સુષ્પ્યો સાદ, સુષ્પ્યો એનો પ્રતિધ્વનિ,
 ને દ્યાના નિજાત્માની દિશામાં એ વળી વદી:
 "દેવી ઓ દુઃખની! માતા દિવ્ય વિધાદની!

અસત્ય વિશ્વનો શોક સહેવાને
 તું અંશ મુજ આત્માનો એક આગે કરેલ છે.
 છે તું તેથી જનો તાબે થાય ના વિધિદંડને,
 પરંતુ સુખને માટે પ્રાર્થી, દૈવ સામે રહે જગ્યામતા;
 છે તું તેથી અભાગીઓ આશા રાખી શકે હજુ.
 પરંતુ તુજમાં શક્તિ છે આશ્વાસનની, અને
 પરિત્રાણતણી નથી.

બળની આપવાવાળી બની પાઈ આવીશ દિન એક હું,
 અને શાશ્વતને ખાલે પિવડાવીશ હું તને;
 પ્રભુના શક્તિના ઝોતો તારા અંગેઅંગમાં વિજયી થશે
 અને પ્રજ્ઞાતણી શાંતિ
 ભાવાવેશે ભર્યા તારા હૈયાને રાખશે વશે.
 તારો પ્રેમ બની જાશે બંધ માનવજ્ઞતિનો,
 અને તારો દ્યાભાવ રાજમાન થતો રાજી બની જશે
 કાર્યોક્રો નિસર્ગનાં:

વિલોપાઈ જઈ દુઃખ ગુજરી જગથી જશે;
 સૂચિ મુક્ત બની જાશે પશુકેરા પ્રકોપથી,

રાક્ષસી કૂરતામાંથી ને એના કખ્ટમાંહાથી.
હરહંમેશને માટે શાંતિ ને શર્મ ત્યાં હશે."

વધી આગળ સાવિત્રી ઉર્ધ્વ ભાર્ગ નિજાતમના.
પર્જા-પિચ્છી વૃક્ષકો ને ખડકો ચઢ્ણે હતાં
દીપ્તભાવી ભવ્ય શોભાવડે ભર્યો,
શાંત સમીર હૈયાને ઉખ્મા દેતો ચાટુકાર બન્યો હતો,
નાજુક તરુઓમાંથી સૂક્ષ્મ એક સુગંધી શ્વાસ ઉઠતો.
બધું સુંદરતાયુક્ત, સૂક્ષ્મ, ઉચ્ચ ને વૈચિન્યભર્યું બન્યું.
ભીમકાય અહીં એક ગાદીકેરા આકારે કોતરાયલા
શિલાપટ પરે નારી હતી એક વિરાજિતા
સોનેરી ને જામલી ચમકે સજી,
હતી ત્રિશૂળધારી એ અને વજે સજાયલી,
પાય એના હતા પીઠે એક પોઢેલ સિંહની.
એના ઓઠો પરે એક હતું સ્મિત ભયંકર,
એની આંખોતણે ખૂઝે સ્વર્ગ અર્દિન કરી હાસ્ય રહ્યો હતો;
શૌર્ય ને શક્તિ સ્વર્ગાય એને દેહે પુંજીભૂત બન્યાં હતાં,
પાતાળી દેવતાઓની જયની એ તર્જના કરતી હતી.
એના ભસ્તકની આસપાસ એક આભામંડળ જે હતું
તે જવાણાઓ કાઢનારી વિદ્યુતોનું બન્યું હતું,
સર્વોપરિત્વની મોટી મેખલાથી જામો એનો સજ્યો હતો,
ને એની સાથ રાજીત હતાં રાજીત ને જય,
વિશ્વકેરા વિશાળા સમરાંગણે
સપાટ સાભ્યની સામે મૃત્યુના, ને સૌને સમ બનાવતી
બળવાખોર રાત્રીની સામે એ રક્ષતાં હતાં
શ્રેણિબદ્ધ શક્તિઓની વ્યવસ્થિત પરંપરા,
અવિકારી મૂલ્યો ઉદાત્તતાત્ષાં,
તુંગતાઓ શિખરોએ વિરાજતી,
સત્યકેરું આલિજાત્ય હક ખાસ ધરાવતું,
ને આદર્શતણા શાસક સૂર્યમાં

ત્રિપુરી પ્રાજ્ઞતાની ને પ્રેમની ને પ્રહર્ષની,
અને એકમાત્ર એકતંત્ર રાજ્ય કેવલાત્મક જ્યોતિનું.
મનની ભીતરી ભોગે વિરાજંતી ભવ્યરૂપ નિજાસને
માતા શક્તિમયી જોતી હતી નીચે વહેતી વહેતું અનુભૂતિ પ્રતિ,
આગળ વધતાં કાળ-પગલાંના ઘણનિને સુણતી હતી,
સુર્યોનાં ચક્કરો જોતી હતી અપ્રતિરોધ્ય એ,
અને સાંબળતી 'તી એ ગગડાટ પ્રલુકેરા પ્રયાણનો.
લોલકાતાં બળો વચ્ચે સંધર્માંથી અનુભૂતિ,
એની જ્યોતિર્ભવી આજ્ઞાકેરો શબ્દ શ્રેષ્ઠસર્વથકી હતો,
રણનાદ સમી એની વાણી નિનદ્તી હતી,
કે યાત્રીના સ્તોત્રગાન સમી હતી.

હારી ગયેલ હૈયામાં ફરી આશા જગાડતો
સમર્થ સૂર સંવાદી મંત્ર જેવો એનો ઉચ્ચ સમુચ્ચયો:
"ઓ સાવિત્રી! હું તારો ગુપ્ત આત્મ છું.
છું આવી હું ઉંતરીને માનવી લોકની મહી
અને પ્રવૃત્તિ એની હું નીરખું છું એક નિર્નિદ્ર આંખથી,
આવી છું જ્યાં ધરાકેરા ભાગ્યની છે કાળુડી વિપરીતતા,
ને જ્યાં ઉજ્જવળ ને કાળાં બળોનું ધમસાણ છે.
પૃથ્વીના ભય ને શોકે ભરેલા મારગો પરે
કરું અભાગિયાંઓને હું સહાય
ને બચાવી લઉં છું હું સર્વનાશતણા ભોગ બનેલને.
બદલો બળવંતોને તેમના બળનો દઉં,
બળ મારું દુર્બળોનું બની બખ્તર જાય છે;
લાલાયિત જનોને હું દઉં હર્ષ તેમની લાલસાતણો:
ટોળાની તાળીઓકેરું અનુમોદન પામતા
દાનાઓ ને મહાનોને ન્યાયયુક્ત ઠરાવંત નસીબ હું,
પછીથી કુચરી નાખું તેમને હું
લોહ-નાળી એડી હેઠ અદૃષ્ટની.
લળેલો કાન છે મારો દલિતોના આર્ત પોકારની પ્રતિ,
નાખું છું ઉથલાવી હું અત્યાચારી રાજાઓનાં સિંહાસનો:

બહિષ્કૃત, શિકારાર્થ શોધાતાં જીવનોતણો
 કૂર જગતની સામે પોકાર એક ઉઠતો
 આજીજીએ ભરી મારી પાસે અપીલ લાવતો,
 એ અવાજ ત્યક્તનો ને અનાથનો
 ને કારાગારમાં પૂર્યા એકાંકી બંદિવાનનો.
 મારા આગમને લોકો લે વધાવી શક્તિ સર્વસમર્થની
 યા તો સાભાર આંસુએ સ્તવે એની કૃપા ઉદ્ઘારકારિણી.
 વિશ્વને આક્રમી લેતા હૈત્યને હું દઉં દંડ પ્રહારથી
 ને એની લોહીએ લાલ બોડે રાક્ષસને હણું.
 છું હું દુગા દૃપ્તાની ને બલવંતોકેરી ઉપાસ્ય દેવતા,
 છું હું લક્ષ્મી રાજરાણી નિષ્ઠલંક અને સૌભાગ્યવંતની;
 કાલીનું મુખ હું ધારું કરું સંહાર તે સમે,
 ખૂંદું હું પગની નીચે શબો દૈત્યદલોતણાં.
 પ્રભુએ છે મને સોંઘું નિજ ઉર્જિત કાર્યને,
 પાઠવી છે મને જેણે તેની સેવું ઈચ્છા લાપરવાઈથી,
 નિઃશંક ભયની પ્રત્યે, પરિણામ પ્રત્યે પાર્થિવ હું તથા
 પુણ્ય ને પાપકેરા ના તર્કવિતર્કમાં પડું
 પણ મારે ઉરે એણે મૂકેલા કર્મને કરું.
 ડરું ના સ્વર્ગકિરા હું ભૂ ભંગે રોખથી ભર્યા,
 નારકી હુમલો લાલ આવે તેથી ડગું નહીં;
 નાખું હું કચડી દેવલોકના પ્રતિરોધને,
 ચાંપું ચરણની હેઠ પિશાચોની બાધાઓ લાખ લાખ હું.
 માર્ગે પ્રભુતણે દોરી જઉં છું હું મનુષ્યને
 અને એની કરું રક્ષા રક્તવણી વરુ ને વિષવ્યાલથી.
 મેં એના મર્ય હસ્તે છે સ્થાપી મારી તરવાર ધુલોકની
 ને વક્ષસ્ત્રાણ દેવોનું છે ખોરાવેલ એહને.
 મનુષ્યમનનો મૂઢ ગર્વ ખંડિત હું કરું
 અને વિશાળતા પ્રત્યે સત્યકેરી જઉં દોરી વિચારને;
 સાંકડી સફલીભૂત જિંદગી હું વિદારું છું મનુષ્યની
 ને સૂર્ય માંડવા મીટ બેળે પ્રેરું આંખો શોકાર્ત એહની,

કે મરે એ મહી માટે અને જીવે નિજાતભમાં.
 જાણું છું લક્ષ્ય હું, જ્ઞાન મને છે ગુપ્ત માર્ગનું:
 અદૃશ્ય ભુવનોકેરા નક્ષાનો મેં અત્યાસ કરેલ છે;
 યુદ્ધનો મોખરો છું હું, છું સિતારો પ્રયાણનો.
 પરંતુ પ્રતિરોધે છે બોલ મારો જગ જંગી હેઠે ભર્યું,
 ને માનવી ઉરે છે જે વક્તા ને અનિષ્ટ, તે
 બુદ્ધિથી બળિયાં છે ને છે ઊડા ઘોરગર્તથી.
 ને વિરોધી બલોકેરો વિદ્ધેષ ચતુરાઈથી
 પાછું મૂકે ફેરવીને ભાગ્યના ધરિયાળને
 ને સનાતનની ઈચ્છા થકી જ્યાદા બળવાન જણાય એ.
 અનિષ્ટ વિશ્વનું ઊંઠું અતિશે છે
 ને ઉન્મૂલ કરી એને નાખવું એ અશક્ય છે:
 વિશ્વનું હુઃખ એવું તો વિશાળું છે
 કે ન પ્રાપ્ત થતું ઓસડ એહનું.
 મારી પાસે થઈ થોડા જે જ્યોતિ પ્રતિ જાય છે
 તેમને હું માર્ગદર્શન આપતી;
 થોડાકને બચાવું છું, મોટો ભાગ બચાવ્યા વણનો રહી
 પડી પાછળ જાય છે;
 થોડાકને કરું સાથી, મથામજા કરી કરી
 ઘણા નિષ્ફળ જાય છે:
 કરતી હું રહું મારું કાર્ય કિંતુ કરી કઠણ કાળજુઃ
 પ્રકાશ પૂર્વમાં ધીરે ધીરે છે વધતો જતો,
 માર્ગ પ્રલુતણા વિશ્વ ધીરે ધીરે વધ્યે જતું.
 મારા કાર્ય પરે સીલ પ્રલુની છે મરાયલી
 અને એની શક્ય નિષ્ફળતા નથી:
 વિશ્વના આત્મને જ્યારે મળવાને બહાર આવશે પ્રલુ
 ત્યારે ઊઘડતાં દિવ્ય દ્વારોકેરો રવ રૌખ્ય સુણીશ હું."
 બોલી એ ને નિઝનેરા માનવી લોકમાંશથી
 મળ્યો જવાબમાં એનાં વચનોને પડવો વિકૃતાયલો;
 અવાજ આવતો 'તો એ ખર્ચ અસુર સત્ત્વના

મનકેરા અવકાશોમહી થઈ,
 વિરુપાંગ શૂંખલાએ બદ્ધ છે જેહ દેવતા
 જે પોતાની બંદ્ખોર સામગ્રીને સ્વભાવની
 વશમાં આણવાતણા
 અને ઓજાર પોતાનું બ્રહ્માંડને બનાવવા
 કેરા મહાપ્રયાસે વ્યગ્ર હોય છે.

કામનાના આ મહાન સચરાચરનું ‘અહં’
 પૃથ્વીની ને બૃહદાકાર સ્વર્ગની
 માનવી ઉપયોગાર્થે દાવા સાથે માગણી કરતું હતું,
 પૃથ્વી ઉપર પોતે જે ઘડી જીવન છે રહ્યું
 તેને માથે માનવી છે વિરાજતો
 તેનો પ્રતિનિધિ છે એ, તેનો સચેત આત્મ છે,
 વિકાસ પામતી જ્યોતિ ને શક્તિનું પ્રતીક છે,
 અને જે દેવતારૂપ થવું પ્રકટ જોઈએ
 તેનું આધારપાત્ર છે.

વિચાર કરતું પ્રાણી, પ્રકૃતિનો ઉધામા કરતો પ્રભુ,
 એણે એને બનાવી છે ધાત્રી, શસ્ત્ર, ગુલામડી,
 અને વેતનમાં એને ને એને પરિલાભમાં,
 છટકાય ન જેનાથી એવા ઊંડા નિયમે વસ્તુઓતણા
 આપે છે નિજ હૈયાનો શોક, આપે દેહનું મૃત્યુ ને વથા;
 બને માણસનાં દુઃખો સાધનો પ્રકૃતિતણાં
 વૃદ્ધિ ને દૂઢિ માટેનાં અને સંવેદનાતણાં;
 મૃત્યુ માણસનું સાથ્ય કરે એને પ્રાપ્તિમાં અમૃતત્વની.
 હથિયાર અને દાસ એ પોતાની દાસી ને હથિયારનો
 શ્લાઘા સ્વતંત્ર સ્વેચ્છાની ને મહોચ્ચ પોતાના મનની કરે,
 એને પ્રકૃતિ પોતાના ચૂન્યા માર્ગો પર જાય ધકેલતી,
 સ્વામી સ્વામિત્વની નીચે આવે છે એ, શાસ્ત્ર શાસ્તિ થાય છે,
 સ્વયંચાલિત ધંત્ર એનું બને છે એ સચેતન,
 ભોળે ભાવે કામનાથી એની એ ભોળવાય છે.
 એનો ચૈત્યાત્મ મુદ્રાન એનો છે, છે રાજા મૂક, અચેષ્ટન,

એનું શરીર છે એનો યંત્રપુત્ર,
 અને છે જિંદગી એની એહની જીવનપ્રથા,
 સચેત મન એનું છે બલી બંડખોર સેવક એહનો.
 અવાજ એ ચઢ્યો ઊંચે
 ને પ્રહાર કર્યો એણે અંતરસ્થ કો એક સૂર્યની પરે:
 "હું પૃથ્વી પરનાં ઓજોકેરો વારસદાર છું,
 ધીરે ધીરે બનાવું છું સિદ્ધ મારા ભૂમિના અધિકારને;
 એના દિવ્યત્વ પામેલા કર્દમે છું દેવ હું વૃદ્ધિ પામતો,
 આરોહું હું કરી દાવો ગાદી ઉપર સ્વર્ગની.
 જુન્મેલો સર્વને અંતે પૃથ્વીનો હું બની પ્રથમ છું ખડો;
 એની મંદ સહસ્રાબ્દીઓ જોતી 'તી વાટડી મુજ જુન્મની.
 જોકે વાસ કરું છું હું મૃત્યુ-ઘેરેલ કાળમાં,
 ને અનિશ્ચિત છું સ્વામી હું મારા દેહનો ને મુજ આત્મનો
 જેમને ઘરને સ્થાને મળ્યું નાનું ટપકું તારકો વચે,
 મારે માટે અને મારા ઉપયોગાર્થ તે છતાં
 વિશ્વ છે વિરચાયલું.
 વિનાશ પામતી માટીમહી અમર આત્મ હું,
 છું હું માનવને રૂપે હજી અવિકસ્યો પ્રભુ;
 હોય એ ન છતાં છે એ મારામાં સંભવી રહ્યો.
 મારા માર્ગ પરે સૂર્ય અને ચંદ્ર પ્રદીપકો;
 ફેફસાંને કાજ મારાં શાસ લેવા હવાની શોધ છે થઈ,
 વિશાળા ભીતની આડ વિનાના અવકાશને
 સ્વરૂપે એ અનુકૂલિત છે બની,
 પાંખાળા રથનાં મારા ચકો એને ચીરીને માર્ગ મેળવે,
 તરવા, સરવા નાવે મારે માટે સિંધુ છે સરજાપલો,
 એ મારું સ્વર્જ-વાણિજ્ય વહે છે પીઠની પરે:
 મારી મોજતણા નૌકાતલે સરકતા જતા
 ચિરાઈ હાસ્ય એ કરે,
 દૈવ ને મૃત્યુની એની કાળી તાકકેરી હાંસી કરેંત હું.
 પૃથ્વી ભૂ-તળિયું મારું ને આકાશ છાપરું જિંદગીતણું.

અનેક મૌનથી પૂર્ણ યુગોમાં આ સૌ તૈયાર થયું હતું.

પ્રયોગો પ્રલુબે કીધા પ્રાણી-આકૃતિઓ લઈ

ને તૈયાર થયું સર્વ તે કેદે જ જન્મ મારો થયો પછી.

જન્મ્યો દુર્બળ ને નાનો અને અજ્ઞાનપૂર્ણ હું,

જીવ એક નિરાધાર મુશ્કેલીઓતણા જગે,

દ્વાંકા વખ્તામહી મારાં મૃત્યુને પડખે લઈ

કરું છું હું મુસાફરી:

મોટો પ્રકૃતિથી છું હું થયો, શાસ્ત્રો અદકો પરમેશાથી.

કદી પ્રકૃતિએ જેનું સ્વખે સેવ્યું હતું નહીં

તેને મેં સિદ્ધ છે કર્યું,

શક્તિઓ જુંટવી એની જોતરી છે મારું કાર્ય કરાવવા

આખ્યો છે ધાટ મેં એની ધાતુઓને, નિપજાવેલ છે નવી;

દૂધમાંથી બનાવીશ કાચ ને કપડાં વળી,

લોઢું મખમલી, પાણી બનાવીશ અભંગુર શિલામય,

કલાકારીગરીકેરી ચાલાકીથી કરે છે પ્રલુબ તેમ હું

રચીશ બહુશઃ રૂપો એક આદ્ય તત્ત્વથી જીવકોષના,

કોટિશઃ જીવનો એકમાત્ર પ્રકૃતિ ધારતાં,

કલ્પનાથી જાય કલ્પયું મનમાંહે અગોચર પ્રકારનું

તે સર્વેને સ્થૂલ રૂપે નવે ધાટે ધરીશ હું

ધાટગ્રાહી ધન નક્કર રૂપમાં;

પદૃતા મુજ જાદૂની બીજા સર્વે જાદૂઓથી બઢી જશે.

એવો એકે ચમત્કાર નથી જેને કરીશ નહિ સિદ્ધ હું.

ઈશે અપૂર્જ છોડ્યું જે તેને પૂર્જ કરીશ હું,

ગુંચોવાળા ચિત્તમાંથી અને અધ્વરી વિરચાયેલ ચૈત્યથી

એનાં પાપ અને ભૂલ કરી નાખીશ દૂર હું;

એણે નવું ન નિર્ભું જે તે નિર્માશ નવીન હું:

એ હતો આદિ ઝાખ્યા, હું છેલ્લો સર્જનહાર હું.

જેમાંથી જગતો એણે બનાવ્યાં છે

શોધ મેં તે અજ્ઞુઓની કરેલ છે:

વૈશ્વ શક્તિ આદ્ય ઘોરરૂપ કાર્યે પ્રયુક્તા તે

ઇલંગ મારતી મારા સજીતીય શત્રુઓ નાખશે હણી,
નાખૂદ કરશે રાખ્રુ કે સમાપ્ત જાતિને નાખશે કરી,
હતાં જ્યાં હાસ્ય ને હર્ષ ત્યાં છોડશે મૌન કેવળ મૃત્યુનું.

યા અદૃશ્ય અણુકેરું વિખંડન
પ્રભુની વાપરી શક્તિ સુખો મારાં વધારશે,
વિત્તની કરશે વૃદ્ધિ, ને અત્યારે ચાલતો વિદ્યુતો વડે
રથ મારો, તેને વેગ સમર્પશે
અને મારા ચમત્કારોત્સાં ચક્કો ચલાવશે.
પ્રભુના હાથમાંથી હું એનાં જાદૂગરીનાં સાધનો લઈ
એનાં ઉત્તમ આશ્રયોથકી મોટાં સાધીશ તેમના વડે.
કિંતુ એ સર્વમધ્યે મેં સમતોલ રાખ્યો છે સ્વ વિચારને;
મારા સ્વરૂપનો છે મેં કર્યો અભ્યાસ, ને કર્યું
 છે પરીક્ષણ વિશ્વનું,
જિંદગીની કળાઓની પર મારું છે પ્રભુત્વ સ્થપાયલું.
કેળવી જંગલી જીવ એને મારો મિત્ર છે મેં બનાવિયો;
સાચવે ઘર એ મારું અને મારી ઈચ્છાની રાહ એ જુએ
 ઉંચી આંખ કરી કરી.

મેં મારી જાતિને શિક્ષા આપી છે સેવવાતણી
 અને આજ્ઞાધીનતા રાખવાતણી.

વૈશ્વિક લહરીઓની રહસ્યમયતાતણો
ઉપયોગ કરી દૂર-દૂષ્ટ મેં મેળવેલ છે,
 સુણું છું હું શબ્દો દૂર સુદૂરનાઃ
છે મેં આકાશને જીત્યું અને સારી પૃથ્વી છે નિકટે ગ્રથી:
અદ્ય સમયમાં ગુહ્યો જાણીશ મનનાંય હું:
જ્ઞાન-અજ્ઞાનની સાથે મારી રમત ચાલતી,
પાપ ને પુષ્ય છે મારી શોધકેરી કરામતો,

 જેમની હું પર પાર જઈ શકું
યા તો પ્રભુત્વની સાથે જેમને હું ઉપયોગે લઈ શકું.
જાણીશ ગૂઢ સત્યો હું, કબજે હું કરીશ ગૂઢ શક્તિઓ.
દૂષ્ટમાત્રે કે વિચારમાત્રે મારા શત્રુઓને હણીશ હું,

સધળાં હૃદયોકેરી અનુચ્ચારિત લાગણી

સંવેદી હું લઈશ ને

જોઈશ ને સાંભળીશ માણસોના સંતાપેલ વિચારને.

બનીશ પ્રભુ પૃથ્વીનો, તે પછી હું જીતીશ સ્વર્ગલોકને;

બનશે સહયોગીઓ દેવો મારા કે મારા પરિચારકો,

મારી સેવેલ એકે ના ઈચ્છા જાશે મરી વણપુરાયલી:

સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા, બન્ને મારાં બની જશે."

સાવિત્રીએ સુણ્યો સૂર અને એનો વિરૂપ પડધો સુણ્યો

ને પોતાના શક્તિકેરા આત્મા પ્રત્યે વળી એ આમ ઉચરી:

"મહાબલતણી માતા! માતા કર્મોત્ષી ને માત ઓજની,

તું છે મારા ચિદાત્માનો અંશ એક

મનુષ્યજાતિને સાહ્ય આપવા ને

કાળકેરા કાર્યને સાહ્ય આપવા

પ્રાદુર્ભૂત કરાયલો.

તું છે માણસમાં તેથી રાખે છે એ આશા ને હામ ભીડતો;

તું છે તેથી મનુષ્યોના આત્મા સ્વર્ગ આરોહી શક્તા અને સાન્નિધ્યે પરમાત્માના દેવો જેમ ચાલવાને સમર્થ છે.

કિંતુ પ્રક્ષા વિનાની છે શક્તિ વાયુ સમોવડી,

શ્વસી એ શક્તિ શુંગો ઉપરે ને ચૂમી આકાશને શકે

કિંતુ નિમી શકે ના એ છેક પારતણી શાશ્વત વસ્તુઓ.

આઘ્યું છે માનવોને તેં બળ, આપી પ્રાજ્ઞતા તું શકી નથી.

એક દિવસ આવીશ પાછી હું જ્યોતિને લઈ,

ત્યારે આદર્શ આપીશ હું તને પરમેશનો;

પ્રભુ જેહ પ્રકારે તે પ્રકારે તું જોશે જીવાત્મ ને જગત્

પ્રતિબિંબન પામેલાં ચૈત્યાત્માના તારા સ્વર્ણ સરોવરે.

જેવી વિશાળ છે તારી શક્તિ તેવું જ્ઞાન તારું બની જશે.

પછી માનવ હૈયામાં ઝેરવેર જેવું રે'શે નહીં કશું.

જીવનોને મનુષ્યોના તજી જાશે ભય ને બલહીનતા,

શમી અંતરમાં જાશે અહંતાનો અવાજ, ને

વિશ્વને ભોજ્યને રૂપે

દાવા સાથે માગનારી એની સિંહગર્જનાય શામી જશે,
મહાબલ બની જાશે બધું, જાશે બની સર્વ મહામુદા
અને શક્તિ સુખે ભરી."

હજ્ય ચઢતાં ઉંચે ઉર્ધ્વ માર્ગ નિજાતના
આવી પ્રવેશ પામી એ ઉચ્ચ એક સુખિયા અવકાશમાં,
મિનારો એક મોટો ત્યાં હતો દર્શનનો, બધું
અવલોકી શકાતું 'તું જહી થકી.

ને કેન્દ્રિત થયું 'તું જ્યાં સર્વ એક જ દૂષ્ટિમાં,
જેમ દૂરત્વને લીધે પૃથ્ફ દૃશ્યો એક શાં જાય છે બની
ને પરસ્પર સંગ્રામ કરનારા રંગોમાં મેળ આવતો.
નિઃસ્પંદિત હતો વાયુ ને સુગંધે હવા ગાઢ ભરી હતી.
કલગાન વિહંગોનું ને ગુંજાર મધમાખોતણો હતો,
ને હતું સર્વ ત્યાં છે જે સાધારણ પ્રકારનું,
નૈસર્જિક અને ભીંહું ને છિતાંયે
હૈયા ને આત્મની સાથે દિવ્યતાનો ગાઢ સંબંધ રાખતું.
સામીય પુલકે પૂર્ણ હતું આત્માકેરું સ્વ-મૂળ સાથનું,
ને પ્રત્યક્ષ લાગતી 'તી ગૂઢમાં ગૂઢ વસ્તુઓ
સમીપસ્થ ને યાથાતથ્યથી ભરી.

જીવંત કેન્દ્રરૂપે એ શાંતિની દર્શનાત્મા
અહીયાં એક બેઠી 'તી નારી સ્વર્ણ અને સ્ફાટિક જ્યોતિમાં:

એની આંખોમહી સ્વર્ગ સ્વપ્રકાશ અનાવૃત્ત કર્યો હતો,
ચંદ્રપ્રભા સમા એના હતા પાય, અને હતું

મુખ એનું તેજસ્વી સૂર્યના સમું:

મૃત ને દીર્ઘ હૈયાને સિમત એનું પુનર્જીવન પામવા
અને શાંતિતણા હસ્ત લહેવાને મનાવી શકતું હતું.

સુણાતું મંદ સંગીત સ્વર એનો ખવમાન બની ગયો:

"હું છું તારો ગૂઢ આત્મા, હે સાવિત્રી!

ધવાયેલી ને અદૂલી પડેલી પૃથિવી પરે

આવી છું ઉતરી નીચે દુઃખ એનાં શમાવવા,

હૈયું એનું હુલાવીને એને આરામ આપવા,
ને અંબાના અંકમધ્યે એનું મસ્તક મૂકવા,
જેથી એ પ્રભુનાં સ્વખ સેવે, એની શાંતિને થાય માણતી,
અને કઠોર ને તિલઘ પૃથિવીના દિનોના તાલની મહી
સ્વરમેળ સુસંવાદી તાજી આંશે ઉદ્ઘનાં ભુવનોતણો.

પ્રકાશમાન દેવોનાં એને હું દર્શનો દઉં
અને તડફંતી એની જિંદગીને બળ ને સાંત્વના દઉં;
વસ્તુઓ ઉચ્ચ અત્યારે છે જે માત્ર શબ્દો ને માત્ર રૂપકો
તેમને હું કરું ખુલ્લી એની આગળ તેમના

શક્તિકેરા સ્વરૂપમાં.

ચોર પેઠે પ્રવેશાંતી છું હું શાંતિ

યુદ્ધે લોથપોથ હૈયે મનુષ્યના,
રાજ્યે નરકના એનાં ફૂત્યોએ સરજાયલા
છું હું સરાઈ વાસો જ્યાં દેવદૂતો કરી શકે;
છું હું સદ્ભાવ જે આપે આશીર્વાદો દ્યાભાવભર્તી કરે;
છું હું નીરવતા કોલાહલપૂર્જ સંચારે જિંદગીતણા;
છું હું જ્ઞાન દઈ ધ્યાન વિશ્વકરો નકશો નિજ ન્યાળતું.

જે અસંગતતાઓ છે માનવી હદ્યે ભરી,
ભલાઈ ને બુરાઈ જ્યાં સુઅ સાથે અડોઅડ જ સેજમાં
ને જ્યાં પ્રકાશની પૂઠે પડેલો છે અંધકાર પદે પદે,
એનું સૌથી વિશાળું જ્યાં જ્ઞાન અજ્ઞાન માત્ર છે,
ત્યાં છું હું શક્તિ સેવંતી શ્રમ સર્વોચ્ચ કારણે,
કરતી પ્રભુને માટે કામ, ઊંચે શિખરો પ્રતિ પેખતી.

પાપ ને તુટિનેયે હું પગલાંને માટે પગથિયાં કરું,

અને પ્રકાશ પ્રત્યેની

લાંબી યાત્રાતણું રૂપ આપું સૌ અનુભૂતિને.

અચેતનમહીથી હું ઊભું ચેતનને કરું

ને મૃત્યુમાં થઈ દોરી જઉ અમર જીવને.

બહુ છે પ્રભુનાં રૂપો જે દ્વારા એ વૃદ્ધિ પામે મનુષ્યમાં;

મારે એ દિવ્યતાકેરી

ઇએપ એના વિચારો ને એનાં આચરણો પરે,
માનવી મૃત્તિકાકેરા માપને એ ઊંચાઈઓ સમર્પતાં,
કે રૂપાંતર ધીરેથી પમાડીને

એને સ્વર્ગતણું સોનું બનાવતાં.

પ્રભુ છે શુભ જે માટે માનવીઓ કરે યુદ્ધ અને મરે,
પ્રભુ છે ધર્મનું યુદ્ધ અધમસુર સામને,
છે એ મુક્તિ ચિતામાંથી પોતાની જે મૃત્યુથી મુક્ત ઉઠતી,
છે એ શૌર્ય ટકીને જે કરે રક્ષા મરણોન્યુખ માર્ગની,
કે અદૂલો એ ટટાર રહે ઉભો છિન્નવિચ્છિન્ન મોરચે,
કે ધોર પડછંદાતી રાતે છે ચોકિયાત એ.
એ છે મુગાટ ઝાળોમાં જળાવેલા શહીદનો,
અને સાનંદ કીધેલું સંતકેરું ઈશ્વરપ્રણિધાન એ,
અને એ વીરતા છે જે કાળકેરા ધાવ લેખવતી નથી,
મૃત્યુ ને દૈવની સાથે મલ્લ યુદ્ધે ઉત્તરેલું મહાબલ
 છે એ ઓજસવંતનું.

મહિમોજજવલ ગાદીએ છે મૂર્ત્તિમંત જ્ઞાન એ,
મનીધીના રાજ્યની એ પ્રશાંતા એકતંત્રતા.
છે એ વિચાર ઉત્તુંગ ને એકાકી અજ્ઞાન જનસંઘથી

પર ઊંચે વિરાજતો:

છે એ પેગંબરી શબ્દ, દ્રષ્ટાની આર્ધ દૃષ્ટિ એ.
છે એ સૌન્દર્ય પીયુખ ભાવાવિષ્ટ ચિદાત્મનું,
છે એ સત્ય કરે આત્મા જેનાથી પ્રાજ્ઞધારણા.
છે એ વૈભવસંપત્તિ આધ્યાત્મિક વિરાટની
રેડાતી સ્વાસ્થ્ય દેનારા પ્રવાહોમાં દરિદ્રી જિંદગી પરે;
છે એ શાશ્વતતા એક હોરામાંથી બીજા હોરાતણી મહી

લલચાવાયલી જતી,

છે એ અનંતતા એક નાના શા અવકાશમાં:

મૃત્યુના બાહુઓમાં એ રહેલું અમૃતત્વ છે.

છું હું આ શક્તિઓ ને એ આદ્ધવાને મુજ આવતી.

આમ માનવ આત્માને ઉઠાવી હું લઈ જતી

સમીપતર જ્યોતિની.

પરંતુ નિજ અજ્ઞાને વળગેલું રહે છે મન માનવી,
ને પોતાની ક્ષુદ્રતાને વળગેલું રહે હૈયું મનુષ્યનું,
ને દુઃખશોક માટેના પોતાના અધિકારને
જિંદગી જગતીતણી.

કાળને શાશ્વતી જ્યારે લઈ લે હાથની મહી,
સાન્ત-વિચારની સાથે કરે લગ્ન અનંતતા,
ત્યારે જ જાતથી મુક્તિ માનવી મેળવી શકે
અને વાસ પ્રભુ સાથે કરી શકે.

તે દરભ્યાન દેવોને લાવું છું હું ધરા પરે;
આણું છું આશ હું પાછી નિરાશ હદ્યોમહી;
આપું છું શાંતિ દીનોને અને ગૌરવવંતને
મૂર્ખની ને મનીખીની પર મારા ઢોળું છું હું પ્રસાદને.
હું બચાવીશ પૃથ્વીને બચી જાવા પૃથ્વી કબૂલ જો થશે.
ત્યારે વણઘવાયેલો પ્રેમ આખર માંડશે

પગલાંઓ માટી પર મહીતણી;
મનુષ્યમન સ્વીકારી લેશે સત્યતણા સર્વોપરિત્વને,
ને દેહ ધારશે પારાવાર મોટા પ્રભુના અવતારને."
બોલી એ ને અધોવતી અજ્ઞાનભૂમિકા થકી
આવ્યો પોકાર ને આવ્યો પડધો પ્રવિક્ંપતો
નજીન વિરૂપ રૂપમાં.

શું ખલાએ ઈન્દ્રિયોની બદ્ધ માનવ ચિત્તનો
આકોશ ઉઠતો હતો,

નિજ દેવોપમા શક્તિકેરી જાતો
ફરિયાદ લઈ ગૌરવથી ભરી,
જે મર્યાદા વિચારોની વાડે પુરાયલી હતી,
સાંકળે પૃથ્વીલોકકેરા અજ્ઞાનની બંધાયલી હતી.
બંદી બનેલ પોતાના દેહનો ને માથાનો મર્ય માનવી
મહાસામર્થ્યથી પૂર્જ નિખિલત્વ પ્રભુનું જોઈ ના શકે
કે પડાવે ભાગ એની વિશાળી ને ઊંડી એકાત્મતામહી,

અતક્રિત રહ્યો છે જે જે જ્ઞાનહીન આપણાં હૃદયોમહી
ને પોતે સર્વની સાથે એક, તેથી વસ્તુઓ સર્વ જાણતો.
મનુષ્ય માત્ર જુએ છે સપાટીઓ જ વિશ્વની.
પછી ગોચરની પૂઠે શું સંતાઈ રહેલ છે
તેની વિસ્તિત એ થોડી કરે ખોજ નીચેનાં ગણોમહી;
પરંતુ પડતો બંધ જરાવારમહી જ એ,
અસમર્થ ખોચવાને હાઈમાં જિંદગીતણા,
કે સંબંધ બાંધવાને સ્પંદમાન હૈયા શું વસ્તુઓતણા.
જુએ છે એ સત્યકેરા અનાવૃત શરીરને
જોકે પડી ભરે જાય વાધા પાર વિનાના જોઈ એહના,
કિંતુ એ અવલોકી ના શકે એના અંતરસ્થિત આત્મને.
પછી ઉદ્ઘામ વેગે એ કેવલ જ્ઞાન કારણે
વિગતો સૌ વિદારે ને કરે છે ધાવ, ખોદતો:
ઉપયોગાર્થ ધારે એ છે આકારે જ જે ભર્યું;
સદ્-વસ્તુ છટકી જાય યા ભરી એ જાય એની છરી તળે.
ખીચોખીચ ખજાનાઓ ભર્યા અનંતતાતણા

તે એને ભાસતા માત્ર ખાલી વિસ્તાર યા જંગી મરુસ્થલી.
એણે છે સાન્તને કીધું પોતાનું ક્ષેત્ર કેન્દ્રનું,
વિશ્વેષજ્ઞ કરે છે એ એની આયોજનાતણું
ને એની પ્રક્રિયાઓની પર સ્થાપે પ્રભુત્વને,
સંચાલન કરે છે જે સર્વનું તે

એની દૃષ્ટિથકી છુપાયલું રહે,
પૂઠે અદૃશ્ય છે તેને ચૂકી જાય એની આંખ નિરીક્ષતી.
એની પાસે અંધકેરો સૂક્ષ્મ અચૂક સ્પર્શ છે,
ધીરા યાત્રિકકેરી યા દૃષ્ટિ છે દૂર દૃશ્યની;
આવિઝારક સંપર્કો ચૈત્યાત્માના એના બની ગયા નથી.
છતાંથે આવતી એની પાસે જ્યોતિ આંતર-સ્હુરણાતણી
અને અજ્ઞાતમાંહેથી પ્રેરિત જ્ઞાન આવતું;
પરંતુ ખાતરીબંધ લાગે એને
માત્ર બુદ્ધિ અને સંવેદના ઈન્દ્રિયજ્ઞાનની,

વિશ્વાસપાત્ર સાક્ષીઓ માને એ માત્ર તેમને.
 આમ બાધિત થાયે એ, એળે એનો ભવ્ય પ્રયત્ન જાય છે;
 એની અજ્ઞાનતાકેરા મહાસાગરને તટે
 જ્ઞાન એનું કાંતિમાન કાંકરાઓ નિરીક્ષાતું.
 એ પોકારતણા તેમ છતાં ભવ્ય હતા ભાર સ્વરોતણા,
 એના ધ્વનિમહી કંપમાન થાતો હતો કરુણ વિશ્વનો.
 "મન છું હું ઈશકેરા મોટા અજ્ઞાન લોકનું,
 એણે રચેલ સોપાનો દ્વારા ઊચે આરોહી જ્ઞાનમાં જતું;
 આવિષ્કારક સૌનો હું છું વિચાર મનુષ્યનો.
 દ્રવ્યે ને ઈન્દ્રિયગ્રામે શૂખલાએ બદ્ધ હું એક દેવ છું,
 કાંટાની વાડમાં પૂરી રાખેલું એક છું પશુ,
 વैતરું કરતું પ્રાણી છું હું નીરણ માગતું,
 છું હું લુહાર બાંધેલો નિજ એરણ ને ધમણાભણીએ.
 છતાંય ગાંઠ ઢીલી મેં કરી છે ને વિસ્તાર્યુ મુજ સ્થાન છે.
 માનચિત્ર બનાવ્યાં છે વ્યોમોનાં મેં,

તારાઓનું પૃથ્વેકરણ છે કર્યું,
 કક્ષાઓ વર્ણવી છે મેં ધરેડોમાં આકાશી અવકાશની,
 કોસોનું માપ કાઢ્યું છે સૂર્યોને જે આધા અન્યોન્યથી કરે,
 કાળમાં તેમના દીર્ઘ આયુકેરી છે મેં ગજતરી કરી.
 ખોદીને હું પ્રવેશ્યું છું પેટાળે પૃથ્વીતણા
 ને એની ભૂખરી મંદ માટીએ જે રાખ્યાં છે ધન સંધરી
 તેમને પડ ફોડીને આણ્યાં છે મેં પ્રકાશમાં.
 પડે પથ્થરના એના થયાં જે પરિવર્તનો

કર્યું છે મેં વર્ગાકરણ તેહનું
 ને શોધી તિથિઓ કાઢી છે મેં એના ચરિત્રની,
 બચાવી પૂર્ખ લીધાં છે આખી આયોજનાકેરાં નિસર્ગની.
 ઉત્કાંતિ-તરુની રૂપરેખા મેં સજ્જ છે કરી,
 ડાળ ને ડાળખી, એકે એક પર્ણ છે નિજ સ્થાનમાં જ જ્યાં,
 ગર્ભ પર્યત કાઢ્યું છે પગેરું મેં રૂપોના ઈતિહાસનું,
 અને વંશાવળી છે મેં બનાવી જે જીવે છે તે તમામની.

હે શોધ્યું મેં જીવતત્ત્વ, જીવકોષ ને જાતિ જીવકોષની
ને જીવ એકકોષીય,-પૂર્વજી મનુજાતના,
આદિ રૂપો દીનહીન જેઓમાંથી થયો પ્રકટ માનવી;
કેવી રીતે થયો એનો જન્મ ને એ કેવી રીતે મરી જતો
 તેનું જ્ઞાન મને પ્રાપ્ત થયેલ છે;
ન કિન્તુ હજુ જાણું હું એક આ કે શો એ ઉદેશ સાધતો,
કે કશું લક્ષ્ય છે કે ના, કે છે ઉદેશ કે નહીં,
કે પૃથ્વી પરની શક્તિકેરાં વ્યાપક કર્મમાં
પુરઃપ્રેરણ કો ઋષ સર્જનાત્મક સહેતુક હર્ઘનું
 હે રહ્યું કે નથી રહ્યું.

એની અટપટી છે મેં
પ્રક્રિયાઓ ગ્રહી, બાકી નથી એકે રહી ગઈ:
એની યંત્રાવલી જુંગી આખી છે મુજ હાથમાં:
મેં મારા ઉપયોગાર્થે બનાવી છે બંદી વૈશ્વિક શક્તિઓ.
એનાં અત્યાણુ તત્ત્વોમાં મેં જીણી દૂઢિ છે કરી,
અદૃશ્ય અણુઓ એના ખુલ્લા થઈ ગયેલ છે:
જેને પઢી ગયું છું હું એવો ગ્રંથ બધું દ્રવ્ય બનેલ છે.
માત્ર થોડાંક પાનાંઓ વાંચવાનાં હવે બાકી રહેલ છે.
રાહો જીવનના છે મેં જોયા, જોયા મનના પણ માર્ગ મેં;
કીડી ને વાંદરાની મેં પદ્ધતિઓ પઢેલ છે
ને મેં વર્તન શીખ્યું છે માનવીનું અને કીટક જીવનું.
પ્રભુ જો કરતો હોય કામ તો મેં છે એનાં ગુહ્ય મેળવ્યાં.
પરંતુ હજુ સંદર્ભે રહેલું છે કારણ વસ્તુઓતણું,
એમનું સત્ય ભાગે છે રિક્તતામાં પીછો લેવાય છે તદા;
બધુંય સમજાવાયું હોય ત્યારેય ના કશું
 થયું વિજ્ઞાત હોય છે.

કોણે પસંદ કીધી છે પ્રક્રિયા ને કયાંથી છે શક્તિ ઉદ્ભવી
તે નથી જાણતું હું ને નહીં જાણું કદી પણ કદાચ હું.
રહસ્ય એક છે જન્મ આ પ્રચંડ નિસર્ગનો;
રહસ્ય એક છે ઝોત મનની ભરમજાલનો,

રહસ્ય એક છે તુક્કો બહુરૂપી બનતી જિંદગીતણો.

જે હું શીખેલ શું તેની સામે વિવાદ આદરી

યદૃચ્છા કૂદકો ભરે;

જે મેં રચેલ છે તેને ગ્રહી દૈવ વિદારતું.

જડદ્રવ્યતણી શક્તિકેરાં કાર્યો ખેલેથી જોઈ હું શકું,

કિંતુ જોઈ શકું ના હું પ્રયાત્રાને ભાગ્યકેરી મનુષ્યના:

એની પસંદગીના ના

એવા માર્ગો પરે એને હાંકી લઈ જવાય છે,

ચાલતાં ચકની નીચે ખૂંદાયેલો પડત એ.

મહાન દર્શનો મારાં અનુમાનો છે તર્ક અનુસારનાં;

માનવાત્મા પરે દાવો કરતાં સ્વર્ગ ગૂઢનાં

કલ્પના કરતા માથા કેરું ઊંટવૈદું છે ઘૂર્તતાભર્યુઃ

છે સર્વ સ્વખ યા તો છે સફાબાળ વિચારનીઃ

અંતે જગત પોતે જ બની સંદેહ જાય છે:

ઠઠો અત્યાશુનો દ્રવ્યપુંજની ને રૂપની મશકરી કરે,

હાસ્ય એક ધ્વની ઊઠે સાન્ત છભવેશમાંથી અનંતના.

કદાચ જગ છે ભાંતિ આપણી દૃષ્ટિની થતી,

પુનરાવૃત્ત થાનારી યુક્તિ સંવેદનાતણા

પ્રત્યેક ચમકારમાં,

અસત્ય સત્યતાકેરા દબાણે જન્મ પામતી

દૃષ્ટિથી જીવને નાખી ભરમણામાં દેતું એક અસત્ય મન,

અથવા નૃત્ય માયાનું આવરી લે અણજન્મેલ શૂન્યને.

પહોંચી હું શકું એક વિશાળતર ચેતના

તોયે છે શો લાભ એથી વિચારને ?

એને સદા અનિવાર્ય એના દ્વારા પ્રાપ્ત સદ્-વસ્તુ થાય, કે

એ નિરાકાર આત્માનો લઈ પીછો છેક એની ગુહા સુધી

કરી લે પ્રાપ્ત એહને.

કે અજ્ઞેય બનાવાય નિશાન ચૈત્ય-આત્મનું

તેથી કારજ શું સરે ?

નહીં, દો કરવા કાર્ય મને મારી મર્ત્ય મર્યાદની મહી,

જિંદગી પારની મારે જિંદગી નવ જોઈએ,
 યા તો મનતણી શક્તિ પારકેરું વિચારવું;
 આપણી અલ્પતા રક્ષા આપણી છે અનંતથી.
 જામી ગયેલ ઠંડીથી એકાડી ને નિર્જના ભવ્યતામહી
 મોટા શાશ્વત મૃત્યુથી મરવાને મને બોલાવ તું નહીં,
 શીત વિરાટ આત્માની અમર્યાદિતતામહી
 છોડી દેવાયલું નગન ગુમાવીને પોતાની માનવીયતા.
 પ્રત્યેક જીવ જીવે છે મર્યાદાઓ વડે સ્વીય સ્વભાવની
 ને એ ટાળી શકે કેવી રીતે ભાગ્ય પોતાનું સહજાત જે ?
 છું માનવીય હું, રે'વા મને દો માનવીય તો
 અચિત્માં હું પડું મૂગું ને પોઢી જઉં ત્યાં સુધી.
 મોટો ઉન્માદ છે આ, છે એક કપોલકલ્પના
 કે માટીની મહી છૂપો રહેલો છે પ્રભુ, એવું વિચારવું
 ને સનાતન જે સત્ય તે રહી કાળમાં શકે,
 અને બોલાવવું એને
 કરવાને પરિત્રાણ જાતનું ને જગત્તતણું.
 જે મૂળતત્ત્વનો પોતે બનેલો છે

ખુદ તેને ઝુપાંતરિતતા દઈ
 શી રીતે માનવી મૃત્યુમુક્ત દિવ્ય બની શકે ?
 માયાવી દેવતાઓ આ સ્વખને સેવતા ભલે,
 નહીં સેવે માનવીઓ વિચારતા."

સાવિત્રીએ સુષ્પ્યો સૂર, સુષ્પ્યો વિકૃત ઉત્તર
 ને વદી એ જ્યોતિકેરી નિજાત્માની ભણી વળી:
 "દેવી જ્યોતિર્ભ્યી, માતા આનંદ અથ શાંતિની,
 મારા આત્માતણો છે તું અંશ એક પ્રાદુર્ભૂત કરાયલો,
 ઉદ્ધારી જીવને એનાં ભુલાયેલાં શિખરોએ લઈ જવા,
 ને સ્પર્શોએ સ્વર્ગકેરા ચૈત્યાત્માને જગાડવા.
 તું છે તેથી જતો આત્મા પ્રભુકેરી સમીપમાં,
 તું છે તેથી વૃદ્ધિ પામે પ્રેમ વિદ્ધેષ છે છતાં,
 ને રાત્રિગર્તમાં જ્ઞાન ચાલે વજાહજાયલું.

પરંતુ બુદ્ધિની કાઠી પથરાળ જગ્મીનની
 પર સ્વર્ગતણી સ્વર્ણ વધના વરસાદથી
 માટીમાં પૃથ્વીની ના તરુ નંદનબાગનું
 પુષ્પે પામે પ્રકુલ્લતા,
 ને હિંય લોકનું પંખી આવી બેસે ડાળોએ જિંદગીતણી
 અને મર્ય હવાકેરી મુલાકાતે આવે સ્વર્ગ-સમીરણો.
 વિભાઓ વરસાવે તું અંતઃસ્કુરિત જ્ઞાનની
 તે છતાં માનવીકેરું મન એને પૃથ્વીની માનશે પ્રભા,
 આધ્યાત્મિક અહંભાવે દૂબશે આત્મ એહનો,
 કે જ્યાં પ્રભુતણી શુભ છાયામાત્ર આવવાને સમર્થ છે
 ત્યાં સાધુત્વતણી દીપ્ત કોટડીમાં પુરાયલો
 ચૈત્ય એનો રહેશે સ્વખ સેવતો:
 તારે ઉછેરવાની છે ભૂખ એની શાશ્વત વસ્તુ કાજની
 ને સ્વર્ણ અનિનએ એનું ભરવાનું છે હૈયું તીવ્ર ઝંખતું,
 પ્રભુને આણવાના છે એના દેહ અને જીવનની મહી.
 પ્રભુના હાથ શું હાથ મિલાવીને
 હું આવીશ ફરીથી એક દી અહીં
 અને તું મુખું જોવા પામશે પરમાત્મનું.
 સંપાદિત થશે ત્યારે પ્રાણિગ્રહણ પાવન,
 પ્રભુનો જન્મશે ત્યારે પરિવાર ધરાતલે.
 હશે પ્રકાશ ને શાંતિ સધળાં ભુવનો વિધે."

ચોથો સર્ગ સમાપ્ત